

## તમારો જન્મ કયા વારે થયો હતો?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના દરેક વારનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ પડતો હોય છે. વ્યક્તિનો જન્મ જે વારે થયો હોય તે વારનો પ્રભાવ તે વ્યક્તિના વ્યવહાર અને ચરિત્રમાં પણ જોવા મળે છે.

### • રવિવાર

રવિવારના દિવસે જન્મનાર વ્યક્તિ પર સૂર્યનો પ્રભાવ જોવા મળે છે. તેને કારણે તે વ્યક્તિ તેજસ્વી, ચતુર, ગુણવાન, ઉત્સાહી, દાનવીર, પરંતુ થોડોક ગર્વ કે અભિમાન રાખનાર અને પિત્ત પ્રકૃતિની હોય છે. તેનો સ્વભાવ ખૂબ જ કોઠીલો હોય છે. જે કોઈની સાથે તેને ઝઘડો થાય તો તેમાં પોતાની બધી જ શક્તિ લગાવી દે છે.

### • સોમવાર

સોમવારના દિવસે જન્મ લેનાર વ્યક્તિ પર ચંદ્રના પ્રભાવને કારણે બુદ્ધિમાન, સ્વભાવ અને પ્રકૃતિમાં શાંત, પોતાની મધુર વાણીથી અન્ય લોકોને સરળતાથી મોહી લેનાર હોય છે. આવી વ્યક્તિ રિશ્તર સ્વભાવવાળી, સુખ અને દુઃખ એમ બંને પરિસ્થિતિમાં સંતુલન રાખનારી હોય છે.

### • મંગળવાર

મંગળવારના દિવસે જન્મ લેનાર વ્યક્તિ પર મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે. જેને કારણે તે વ્યક્તિ જટિલ સ્વભાવની, બીજાના કામમાં ખામીઓ શોધનાર, યુદ્ધપ્રેમી, પરાક્રમી, પોતાની વાત પર કાયમ રહેનાર હોય છે. ક્યારેક ક્યારેક તે હિંસક પણ બને છે. તે પરિવારનું નામ રોશન કરનાર હોય છે.

### • બુધવાર

બુધવારના દિવસે જન્મ લેનાર વ્યક્તિ પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે. તેને કારણે આ વ્યક્તિ મધુર વાણી બોલનાર, અભ્યાસમાં રસ ધરાવનાર, જ્ઞાની, લેખક, સંપત્તિવાન હોય છે. આ દિવસે જન્મનાર લોકો કોઈની ઉપર સરળતાથી વિશ્વાસ કરતા નથી. ભલે પછી તે ગાઢ મિત્ર જ કેમ ન હોય!

### • ગુરુવાર

ગુરુવારના દિવસે જન્મનાર વ્યક્તિ પર ગુરુ (બૃહસ્પતિ) ગ્રહનો પ્રભાવ જોવા મળે છે, તેથી આ દિવસે જન્મનાર વ્યક્તિ ભણવામાં હોશિયાર, ધનવાન, જ્ઞાની, વિવેકશીલ અને ઉત્તમ સલાહકાર હોય છે. આ વ્યક્તિ બીજાને ઉપદેશ આપવા હંમેશાં તત્પર રહે છે તથા લોકો પાસેથી માન-સન્માન મેળવીને ખૂબ જ પ્રસિદ્ધિ મેળવવા ઇચ્છતી હોય છે.

- **શુક્રવાર**

શુક્રવારના દિવસે જન્મેલ વ્યક્તિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ હોવાને લીધે તે ચંચળ , ભૌતિક સુખોમાં લિપ્ત રહેનાર, તર્ક-વિતર્કમાં હોશિયાર, ઘનવાન તથા તીક્ષ્ણ બુદ્ધિની સ્વામી હોય છે. જેકે ઈશ્વરમાં તેમની આરથા ઓછી હોય છે. આ વ્યક્તિ પોતાનું આખું જીવન સુખમાં વિતાવે છે.

- **શનિવાર**

શનિવારના દિવસે જન્મનાર વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ જેવા મળે છે. શનિના પ્રભાવને કારણે તે કઠોર સ્વભાવની, પરાક્રમી તથા પરિશ્રમી , દુઃખ સહન કરવાની અદ્ભુત શક્તિ ધરાવનાર , ન્યાયપ્રિય અને ગંભીર સ્વભાવની હોય છે. સેવા કરીને નામ તથા પ્રસિદ્ધિ મેળવનાર હોય છે.